

દેવેન્દ્ર પટેલ

ગુજરાતી ભાષાને સાંપ્રત અને ચિરંતન એવા બંને કાંઠેથી આત્મસાત કરનારા વર્તમાન અને આધુનિક લેખકોમાં દેવેન્દ્ર પટેલનું નામ મોખરે છે. ‘સંદેશ’ આખબાર વર્ચિઝ પત્રકાર અને કોલમ લેખક તરીકે અમની કલમ અભિનપરીક્ષામાંથી પસાર થઈને વધુ વેધક, વધુ કંચનશુદ્ધ બની છે. સામાજિક ઘટનાઓનાં અત્યંત નિકટના સાક્ષાત્કારે અમને હૃદયને ભીજવી દેતી શૈલી દ્વારા ઉત્તમ કથાકાર બનાવ્યા છે. તેમના સ્વભાવમાંની નિખાલસતા અને વાણીમાંની વાકુસ્પષ્ટતા તેમના લેખનને માનવમનની ગાહેરાઈને સમજવાનો નવો જ અભિગમ આપે છે. અમના કથાનકોમાં તળપદી મહેક, આધુનિક જીવનની તાજજૂબી અને ભાવાવેશ સાથે પ્રગાટ થતાં રહે છે. ઉચ્ચ ભૂ સાહિત્યકારોમાં જોવા મળતો ભાષા પ્રસ્તાર તેમને અપ્રિય હોવા છતાં પોતાની વાત કહેવાની એક આગાવી શૈલીમો તેમણે આવિષ્કાર કર્યો છે.

‘સંદેશ’ની દેશ-વિદેશની આવૃત્તિઓમાં લોકપ્રિયતાનાં શીખરો સર કરનાર ‘કભી-કભી’ના કટાર લેખક દેવેન્દ્ર પટેલ દષ્ટિસંપન્ન પત્રકાર, વાર્તાકાર અને નવલકથાકાર પણ છે. ખુશબુદ્ધાર વ્યક્તિત્વ ધરાવતા દેવેન્દ્ર પટેલ સાંપ્રત ગુજરાતી લેખન શૈલીમાં પોતાની આગાવી ઓળખ ઊભી કરે છે. દેશ-વિદેશની અનેક વ્યક્તિઓ તેમની પાસે એક શ્રેષ્ઠ લઈને જાય છે, અંતરને ઉલેચે છે. તેમને પ્રાપ્ત થયેલી ઘટનાઓને એવી ચિત્રાત્મક, કલાત્મક અને પ્રવાહ શૈલીમાં તેઓ આલેખે છે કે વાંચનારની આંખો સમક્ષ નિરૂપાયેલા પાત્રો શાંદ દેહે તરવરી ઉઠે છે. અંતરમાં સંવેદનની ટશરો કુટે છે અને સમાજના બુલંડ પડધા પડે છે. ‘કભી-કભી’ સમાજનું દર્પણ બની ગયું છે. લક્ષ્યવેદની સિદ્ધિ હાંસલ કરનાર શ્રી દેવેન્દ્ર પટેલ અને ‘કભી-કભી’ એકબીજાના પર્યાય બની ગયા છે.

સાબરકાંઠાના નાનકડા ગામ આકર્ષણમાં જન્મેલા દેવેન્દ્ર પટેલે પ્રાથમિક શિક્ષણ તેમના ગામની શાળામાં લીધું હતું અને ‘શ્રેયસ’માં ઉચ્ચ શિક્ષણ લઈ અમદાવાદની સેંટ એવિયર્સ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેઓ મનોવિજ્ઞાનના વિષય સાથે ગ્રેજ્યુએટ થયેલા છે. એ વખતે સેંટ એવિયર્સ કોલેજના પ્રિન્સિપાલ તરીકે ફાધર ડીસોગ્રા હતા. જ્યારે ફાધર વાલેસ, ફાધર લોબો, સંસ્કૃતના અધ્યાપક સી.એલ. શાસ્ત્રી, ગૌતમ પટેલ તથા અર્થશાસ્ત્રના અધ્યાપક પ્રો. બબાભાઈ પટેલના તેઓ પ્રીતિપાત્ર વિદ્યાર્થી હતા.

સેંટ એવિયર્સ કોલેજનો તેમની પર ભારે પ્રભાવ હોઈ વર્ષો પછી તેઓ ઈટાલી-રોમ ગયા ત્યારે ફાધર ડિસોગ્રા એ વખતે રોમમાં સોસાયટી ઓફ જુસસના શિક્ષણ વિભાગના વડા

હતા. એ રોમમાં સેંટ પીટરના ચર્ચ પાસે આવેલા કાસા ફ્લાન્ડેસ્કામાં તેઓ ખાસ અતિથિ બન્યા હતા.

કોલેજનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ ‘ગુજરાત સમાચાર’ માં પત્રકાર તરીકે જોડાયા હતા. એ વખતે ‘ગુજરાત સમાચાર’ના તંત્રી શાંતિલાલ શાહે તેમનામાં રહેલો તરવરાટ નિહાળી કોલેજે અને ચુનિવર્સિટીનું રિપોર્ટીંગ કામ સોંખ્યું હતું. તેઓ થોડાક જ વખતમાં ઝણકી ઉઠ્યા હતા. ‘આકળગંગા’ ના લેખક જયવદન પટેલ એ વખતે ચીક રિપોર્ટર હતા. તેમની રાહબરી હેઠળ તેઓ તાલીમ પામ્યા હતા. ત્યારબાદ ‘ગુજરાત સમાચાર’નું સુકાન ચુવાન મેનેજિંગ તંત્રી શ્રેયાંસભાઈ શાહે સંભાળ્યું ત્યારે તેમણે દેવેન્દ્ર પટેલમાં રહેલી ભીતરી શક્તિઓને પારખીને લખાણ લખવાની અને દેશની મોટી મોટી ઘટનાઓનું સ્થળ પર જઈને રિપોર્ટીંગ કરવા પ્રેર્યા હતા.

ડિસેમ્બર-૨૦૦૭ના તેઓ ‘સંદેશ’માં તંત્રીના સલાહકાર અને કટાર લેખક તરીકે જોડાયા. ‘સંદેશ’ના ‘કબી કબી’, ‘ચીની કમ’, અને ‘રેડરોઝ’ કોલમ દ્વારા લાખ્યો વાંચકોના પ્રિય લેખક બની ગયા. સંદેશમાં તેમણે ‘મહાલતિ પાટીદાર’ અને ‘સલામ શહેરે અમદાવાદ’ની સંશોધનાત્મક શ્રેણી લખી જે ખૂબ જ લોકપ્રિય સાખિત થઈ. ‘સંદેશ’ ના તંત્રી ફાલ્યુનભાઈ પટેલે અને એમ.ડી. પાર્થિવભાઈ પટેલે તેમને લખવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી. ‘સંદેશ’માં જોડાયા બાદ તેમણે તેમની સર્જનાત્મક કલમનો નવો જ દોર શરૂ કર્યો અને ફાલ્યુનભાઈ પટેલ તથા પાર્થિવભાઈ પટેલ સહિત ગુજરાતના લાખ્યો વાંચકોના તેઓ પ્રીતિપાત્ર બની ગયા.

સમાજમાં રોજબરોજ બનતી સામાજિક ઘટનાઓને એક આગાવા દર્ષિકોણથી પરંતુ સરળ અને પ્રવાહી શૈલીમાં પ્રસ્તુત કરવાના હેતુથી ‘કબી-કબી’ કોલમ શરૂ કરવામાં આવી હતી એ ટૂંક સમયમાં આ કોલમને બેહુદ લોકપ્રિયતા સાંપડી હતી. તેમની નકલ કરવા અનેક પત્રકારોએ પ્રયાસ કર્યો હતો પરંતુ બધા જ નિષ્ફળ ગયા હતા. દેવેન્દ્ર પટેલ કહે છે કે ‘સરળ લખવું સૌથી અધરું છે.’

પત્રકારત્વની જરૂર વર્ષની લાંબી યાત્રા દરમિયાન સતત લોકપ્રિયતા ટકાવી રાખી છે. આ દરમિયાન તેમણે અનેક મહાનુભાવોના રૂખરૂ મળી દિનંતરવ્યુ કર્યા છે. જેમાં શ્રીમતી દાનિસા ગાંધી, મોરારજી દેસાઈ, રાજીવ ગાંધી, દલાઈ લામા, અમેરિકાના વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો. ગાલબેથ, આર્થર સી કલાર્ક, જે.આર.ડી. તાતા, નવલ તાતા, મહારાણી ગાયત્રી દેવી, સામ પિત્રોડા, વૈજ્ઞાનિક ડૉ. રામનાથ, આચાર્ય કિપલાણી, અમિતાભ બદ્ધન અને અટલ બિહારી વાજપેયીનો પણ સમાવેશ થાય છે. એક વખતના દેશના ટોચના કુખ્યાત દાણચોર હાજુ મસ્તાન અને ચુસુફ પટેલનો પણ તેમણે દિનંતરવ્યુ કરેલો છે. ભારત-પાક. ચુદ્ધ વખતે સીમલા કરાર દરમિયાન તેમણે પાકિસ્તાનની બોર્ડરમાં

પ્રવેશીને પાકિસ્તાનના ગામોની ચિગ્રાત્મક કથાઓ આલેખી વાચકોને આશ્વર્યચક્રિત કરી દીધા હતા. મોરબીની રેલથી માંડીને અનેક ફુદરતી સંકટોમાં માનવ મૃતદેહોની વર્ણે રઝળપાટ કરીને તેમણે અનેકવાર વાસ્તવિક ઘટનાઓનું અસરકારક રિપોર્ટીંગ કરેલું છે. માત્ર રિપોર્ટીંગ નહીં પરંતુ લોકોની સમસ્યા માટે સત્તાધીશો ધૂજુ જાય તેવી વોહી રફતાર કોલમ માટે પણ તેમણે તેજાબી કલમ ચલાવી છે.

દેવેન્દ્ર પટેલે માત્ર સ્થાનિક ઘટનાઓ પૂરતી જ પોતાની જાતને મર્યાદિત રાખી નથી. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ પર જબરદસ્ત પકડ ધરાવતા આ લેખક તેમના આ દસ્તિકોણ માટે જાણીતા છે. ચુંદ્ર પર પ્રગાટ તેમણે બે પુસ્તકો લખ્યા છે.

૧૯૯૧ના અમેરિકા ઈરાક ચુંદ્ર પર તેમણે ‘ગાફ્ વોર’ નામનું પુસ્તક લખ્યુ હતું. ૨૦૦૩માં ખેલાયેલા બીજા અખાતના ચુંદ્ર પર ‘સદામ હુસેન’ નામનું બીજુ પુસ્તક તાજેતરમાં જ પ્રગાટ થયું છે. નવભારત સાહિત્ય મંદિર, દેરાસર પાસે, ગાંધી રોડ દ્વારા પ્રકાશિત થયેલ આ પુસ્તક વાંચકોમાં બેહુદ લોકપ્રિય સાબિત થયું છે. બધાં મળીને તેમણે ૪૦ જેટલાં પુસ્તકો લખ્યા છે.

દેવેન્દ્ર પટેલના મૌલિક લખાણોવાળા પુસ્તકો પણ એટલા જ જાણીતા છે. તેમણે ‘મન સોનાના તન રૂપાના’ ‘દુર્મી નાતાલ’, ‘પીળી કરેણનું ફૂલ’ શીર્ષક ધરાવતી નવલિકાઓના પુસ્તકો લખેલા છે. જ્યારે તેમણે લખેલી નવલકથાઓમાં ‘કેમ્પફાયર’, ‘લવિંગીયું ધી પ્લોટ’ ‘આવિર્ભાવ’ ‘પુસ્તક એક પલાશનું’ વગેરેનો સમાવેશ થાય છે. ‘પારિજાત’, ‘કોહીનૂર’, ‘ચિત્તવન’, ‘રફકુંવર’, ‘મારિયા’, ‘મૃણાલ’ ‘વેદેહી’, ‘સાકી’. ‘અતરની સુગંધ’, ‘હેનાની સુટકેસ’ વગેરે પુસ્તકો તેમની કબી કબી કથાઓનો સંગ્રહ છે. ‘ઈજરાયેલ ધી લેન્ડ ઓફ ધી બાઈબલ’ પુસ્તકે ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત કરેલું છે. આ સિવાય તેમના ‘મહાજતી પાટીદાર’ અને ‘અમદાવાદ ૬૦૦’ પુસ્તકો અત્યંત લોકપ્રિય છે. ‘ડેડરોગ’ પર આધારીત ‘ચાઈનીઝ ડ્રેગાન’ અને ‘ચીની કમ’ પર આધારીત ‘ડોનને પીસ પ્રાઇગ’ પણ ખૂબ પ્રશંસા પામ્યા છે. ગુજરાતના ગર્ભશ્રીમંતોની કહાણી તેમણે ‘એરિસ્ટ્રોકેટ્સ’ પુસ્તકમાં વર્ણવી છે.

ચાઈલ્ડ હસબન્ડ નામનું નાટક લખીને તેમણે પ્રેક્ષકોને દિગ્મૂઢ કર્યા છે.

‘મિયા ફુસકી-૦૦૭’ નામની ગુજરાતી પટકથા લખીને બાળકોને તથા મોટેરાઓને હસાવ્યા છે.

‘અંતરના એકાંત’ જેવી લાગણીઓની કથાઓ ભરેલી ટેલિવિઝન સિરિયલ લખી તેમણે દર્શકોને ભીજવી દીધા છે.

‘સબ ટીવી’ પરની હિન્દી સિરિયલ ‘દિલ ચાહતા હૈ’ ની કથા પણ દેવેન્દ્ર પટેલે લખી છે. બ્રિટન, ઝાન્સ, ઈટાલી, જર્મની, સ્વિટાર્લેન્ડ, નેધરલેન્ડ, ઈજરાયેલ, મલેશિયા,

આઈલેન્ડ, બેંગાકોક, હોંગકોકથી માંડીને ઓમાન તથા અમેરિકાનો અનેકવાર પ્રયાસ તેઓ ખેડી ચૂક્યા છે.

સરનામું :

દેવેન્દ્ર પટેલ

E-Mail : pdevendra1010@yahoo.co.in.

પુસ્તકો મેળવવાનું સ્થળ :

નવભારત સાહિત્ય મંદિર

ગાંધીરોડ, પતાસા પોઠ, સામે, જૈન દેરાસરની બાજુમાં, અમદાવાદ-૩૮૦ ૦૦૧

* * *

નવભારત સાહિત્ય મંદિર

૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૪.